

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી –

૨૦૨૪ ના ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ઓનલાઇન શાળા પસંદગી

અંગેની સૂચનાઓ

- બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ નું ફાઇનલ મેરીટ લિસ્ટ તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
- ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને આ અંગેની જાણ SMS થી પણ કરેલ છે.
- ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ આચાર્યની ખાલી જગ્યાઓ સામે ઓનલાઇન શાળા પસંદગી આપવાની રહેશે.
- શાળા પસંદગી ફાઇનલ થયા બાદ ઉમેદવારે તેની પ્રિન્ટ મેળવી લેવી જરૂરી છે.
- ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો તા.૦૪/૧૨/૨૦૨૪ થી તા. ૦૯/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૨:૦૦ કલાક સુધી વેબસાઇટ www.gserc.in પર પોતાની ઓનલાઇન શાળા પસંદગી આપી શકશે.
- ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી ઓનલાઇન શાળા પસંદગી ન આપનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયા અવ્યયે પોતાનો હક્ક જતો કરવા ઇચ્છે છે તેમ માની તેઓને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.
- ફાઇનલ મેરીટ લિસ્ટમાં સમાવિષ્ટ થવાથી કે Online શાળા પસંદગી આપવાથી ઉમેદવારનો નોકરીનો હક્ક પ્રસ્થાપિત થઈ જતો નથી. તેની નોંધ લેશો.
- ઓનલાઇન શાળા પસંદગી આપવા માટે,

 - ઉમેદવાર વેબસાઇટ www.gserc.in પર જઈ Apply for Grant-in-aid Principal વિકલ્પ ક્લિક કરવાનો રહેશે.
 - જે ક્લિક કરતા ખૂલેલ ચેકબોક્સમાં ઉમેદવારે પોતાનો HMAT નંબર, HMAT પાસિંગ વર્ષ, જન્મતારીખ, પાસવર્ડ અને ફિક્સ Captcha Code નાખી લોગ-ઈન થવાનું રહેશે.
 - લોગઈન થતાં સ્ક્રીન પર District Selection ના બટન પર ક્લિક કરવાનું રહેશે જેમાં જિલ્લાઓના નામ હશે જે પૈકી મહત્તમ સાત જિલ્લાઓને આપે આપની પસંદગીના ક્રમમાં ગોઠવવાના રહેશે અને ત્યારબાદ save બટન ક્લિક કરતાં આપના બોક્ષમાં આપે જિલ્લાઓ જે ક્રમમાં પસંદ કર્યા હશે તે ક્રમમાં જે તે જિલ્લાની આપને મળવાપાત્ર જગ્યાઓની યાદી આપને જોવા મળશે.
 - જો આપ પુરૂષ ઉમેદવાર હશો તો આપને કન્યાશાળા સિવાયની જગ્યાઓ જોવા મળશે અને જો મહિલા ઉમેદવાર હશો તો આપને કન્યાશાળા સહિતની ભરતી પ્રક્રિયામાં સમાવિષ્ટ તમામ જગ્યાઓ જોવા મળશે.
 - આ રીતે શાળાઓની યાદી જોવા મળ્યાં બાદ આપે આ શાળાઓ પૈકી મહત્તમ સાત શાળાઓને આપના પસંદગીના ક્રમમાં ગોઠવવાની છે. જેમાં જે તે શાળા પર ક્લિક કરતા તે શાળા આપોઆપ સામેના બોક્ષમાં ગોઠવાઈ જશે. આપની ઇચ્છાનુસાર મહત્તમ **સાત(૭) શાળાઓને** પસંદગીના

ક્રમમાં ગોઠવ્યા બાદ આપે **save** બટન ક્લિક કરવાનું રહેશે જે કરવાથી આપની શાળા પસંદગી વેબસાઈટ પર રજીસ્ટર્ડ થઈ જશે. પરંતુ પસંદગી આપ્યા બાદ જો ઉમેદવારને એવું લાગે કે તેઓએ આપેલ પસંદગીમાં કોઈ ક્ષતિ રહી છે અને તેઓ કોઈ ફેરફાર કરવા માંગે છે તો **screen** પર **Reset District** અને **Reset Schools** નું બટન દબાવી તેઓ પોતાની પુનઃ પસંદગી આપી શકશે.

- જો સાત કરતા વધારે જિલ્લા/શાળા પસંદગી કરેલ હશે તો તેવી માહિતી સેવ થશે નહિ. આવા સમયે **Reset selected district list/ Reset selected school list** પર ક્લિક કરી રીસેટ કર્યા બાદ જ પુનઃ પસંદગી આપવાની રહેશે.
- આપે શાળા પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જરૂરી છે. સાત કરતા ઓછી શાળાઓ પણ પસંદ કરી શકાશે, પરંતુ જો કોઈ ૭ થી ઓછી સંખ્યામાં શાળાઓ પસંદ કરે છે અને તેણે પસંદ કરેલી શાળાઓ મેરીટ ક્રમ પ્રેફરન્સમાં તેનાથી ઉંચા મેરીટવાળા ઉમેદવારને મળી જાય તો તેવા કિસ્સામાં તે ઉમેદવારને એકપણ શાળા મળશે નહીં અને પસંદગી યાદીમાં તેનું નામ આવશે નહીં જેની જવાબદારી જે તે ઉમેદવારની રહેશે.
- આમ આ તમામ બાબતોને યોગ્ય રીતે સમજી ખૂબ જ કાળજી પૂર્વક શાળા પસંદગી આપવી.
- ઉમેદવારો પોતાની શાળા પસંદગીમાં શાળા પસંદગી આપવાની છેલ્લી તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી ફેરફાર કરી શકશે.
- છેલ્લે આપે જે શાળા પસંદગી આપેલ હશે તેને અંતિમ માની સોફ્ટવેર ઓટો સબમીટ આપી દેશે અને તદ્દનુસાર આપના મેરીટ મુજબ આપને સોફ્ટવેર ઓનલાઈન શાળા ફાળવણી કરવામાં આવશે.
- શાળા પસંદગી પૂર્ણ થઈ ગયા બાદ તેનું પરિણામ વેબસાઈટ પર મૂકવામાં આવશે જેમાં મેરીટ ક્રમ પ્રેફરન્સના ધોરણે આપને ફાળવેલ શાળાઓની યાદી મુકવામાં આવશે.
- જરૂરી સૂચનાઓ ધ્યાને લઈને જ શાળા પસંદગીની પ્રક્રિયા કરવી. જેથી શાળા પસંદગી આપતા સમયે કોઈ ક્ષતિ ન રહે.
- ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ આપને શુભકામનાઓ પાઠવે છે.

=====